

Barcode - 9999990832909

Title - Gosvami shri harirayachai krut kamakhya dosh vivaran mulak bhashantar vivichan

Subject -

Author -

Language - gujarati

Pages - 42

Publication Year - 0

Creator - Fast DLI Downloader

<https://github.com/cancerian0684/dli-downloader>

Barcode EAN.UCC-13



9999990832909

ગોરવામ્ભી શ્રીહરિશયાચાર્ય કૃત કંદુમાણચદોષવિવરણ.

મૂળ, ભાષા-તરત્વાની વિવેચન સમેત.

પ્રકિંદ કરનારે

લદ્દુભાઈ માણુવદ્ધભદ્રાસ પારેખ.

માઝુ જીઝુ, સ્પેલિકેન કોર્ટ, અમદાવાદ,
“શ્રી વદ્ધિભાચાર્યજીના લઘુનાન્દિન્દ્રિય,”
“શ્રીકૃષ્ણલીલામુદ” ધર્ત્યાહિના કર્તા.

અંશાધિત આવૃત્તિ ખીજ.

એથે રવામીત્વના સર્વ હક્ક સ્વાધીન રાખ્યા છે.

અમદાવાદ.

નિઃ ગુજરાત પ્રિન્ટિંગ પ્રેસ.

વદ્ધિભાચાર્ય ૫૩૨.

સાને ૧૯૧૦.

કિંમત રૂ. બાબુ.

विषय वर्ग : अ

पुस्तकम् ग्रन्थ संग्रहालय विभाग

अनुसन्धान २०१९ वारीक

[ग्रन्थालय कोषभावित विभाग]

गोदावरी विद्यापीठ यंत्रालय

ગોસ્વામી શ્રીહરિરાયાચાર્ય કૃત

કામાખ્યદોષવિવરણ.

મૂળ, અ પાનતર તથા વિવેચન સમેત.

પ્રચિન કરનારે

લદ્ધિભાઈ માણુષભદ્રાસ પારેખ

માટું જાંદું, માંડાંડ તાંડ, અમદાવાં,

“શ્રી વદ્ધિભાચાર્યજીના જીવનચરિત,”

“શ્રીકૃષ્ણલીલામૃત” હંચાદિતા કર્તા.

સંશોદિત આવૃત્તિ ખીંચ.

એથે વાચીએવન અથ હાંડું વાચીન રહ્યા છે.

અમદાવાદ.

નિષ્પત્તિ ગુજરાત પ્રિન્ટિંગ પ્રેસ.

વદ્ધિભાઈ ૪૩૨.

સાલ ૧૯૭૦.

કિંમત એ આના.

ગુજરાત સરકાર
માનવિક
કાળજી

૨૫૧૭

પ્રથમાવૃત્તિની પ્રસ્તાવના.

જે માર્ગમાં ખાનપાનથી કન્દ્રયોજન સારી રીતે પોપળું કરવામાં આવે છે તે માર્ગને પુષ્ટિમાર્ગ કહે છે એમ, શ્રીમહ વદ્વાભાચાર્યજીએ સ્થાપન કરેલા પુષ્ટિ ભક્તિ માર્ગનું અથવા નિર્ણયું ભક્તિમાર્ગનું સ્વરૂપ નહિ જાણુનાર; ધર્માલોકો સમજે છે. આ ખોટી સમજ હર થવાની ધર્માલી અગત્ય છે. હજારો વૈષણવો, અને તેમાંના ધર્માલા વિદ્બાનો આ માર્ગમાં હોવા જતાં, આવી ભૂલ અને રેલી સમજ આ વીચમી જાહી સુધી ચાલે એ એદ્દારક છે. એ જૂદું ભરેલી અમજ હર કરવાને વદ્વાભાચાર્યજીના જીવનચરિત્રમાં કંઈક યત્ન કરવામાં આવ્યો છે. એ યત્ન શ્રીમહાચાર્યજીના રચના અંથીને આધારે કરવામાં આવ્યો છે.

શ્રીચાચાર્યજી મહાપ્રભુજીએ શ્રીમહભાગવતના તૃતી સ્ક્રિંધના ૧૪ માટેઓકની સુઓધિની ટીકામાં લખ્યું છે કે.

કામેન કોવચોભાભ્યામ् કર્મમાર્ગાદ્વાશનમ् ॥

ભાવાથ—કામ, કોધ અને લોલ એ કર્મ, જાન અને ભક્તિ માર્ગનો નામ કરવાનાણા છે.

નિધાધ નામના અંથમાં પણ લખ્યું છે કે

ઇન્દ્રિયાશ્વનિનિગ્રાહ ઇ૦

ભાવાથ—ઇન્દ્રયોજના અથ્વને રોક્ષવા.

એ રીતે અનેક સ્થળમાં શ્રીમહાચાર્યજીએ કામ અને કોધ વિગેરે ઉપર લખ્યું છે. આ કામાખ્યહોયવિવરણ નામનો અંથ એ લખાણેના વિવરણ ઇપ છે.

આ અંથમાં શ્રીહરિરાયજીએ સંપૂર્ણ રીતે ખતાંથું છે કે, પુષ્ટિમાગ વિપયત્તમક કે વિપયવર્ધક નથી પણ વિપય છેક છે.

પુષ્ટિભક્તિમાર્ગના મૂલ પાયો કામ વાસનાના અભાવ ઉપર જ રચાયેલો છે. આત્મનિવેહન અને તદ્વારા પ્રહ્લાસંખંધ એજ એ માર્ગનું પહેલું પગથિયું છે. વિષય-કામ-ના શાશ્વત ઇપ આત્મ નિવેહનથી શરૂ થતો પુષ્ટિભક્તિમાર્ગ એટલે પ્રભુની કૃપાડ્રી સાધનથીજ પ્રભુની સેવા સિદ્ધ કરી પ્રભુ પાહાંભુજમાં જવાનો માર્ગ વિષયાત્મક કે વિષયવર્ધક હોઈ રહેજ નહિ.

એ મૂળ પાયા ઉપર રચાયલી દુર્મારતની લંતો કાળાંતરે આમ તેમ વાંકી વળા ગઈ હોય તો તે માર્ગના જ્ઞાનદ્રુપ એળાંખાથી સાધીને તેને દુરસ્ત કરી તેના ઉપરની દુર્મારતને તેના ધરા સ્વરૂપમાં મૂકવાની અને બતાવવાની જરૂર છે.

એક વખત શ્રીમહ વદ્વલભાચાર્યજીએ આખા ભરતખંડ ઉપર ધર્મ સંખંધી સામ્રાજ્ય મેળાયું હતું, અને એમને તમામ આચાર્યો, પંડિતો અને રાજ્યાંત્રીઓ નમતા હતા. એ વાતે આજ પદ્માંબુજ ગાંધી એટલુંજ નહિ, પણ એજ આચાર્યો સ્થાપન કરેલા માર્ગ ઉપર આજકાલ અનેક આક્ષેપો કરવામાં આવે છે. તેમ છતાં એતન્માર્ગીય વિદ્વાનો સ્વમાર્ગનું સ્વરૂપ સમજવાની અને સમજવવાની કાળજી રાખતા નથી, અને વૃત્તિની ખાતર પારકા કળુઆની વક્તીનાત કરનારની સંખ્યા ધર્ણી મંહાઈ હોવા શતાં સત્યના રક્ષણ મારે પોતાના આચાર્યાં કે ધર્મની વક્તીનાત કરવાને તેઓ ઉદ્ઘાસીન રહે છે તે સુમયની ખલીહારી છે.

આ કામાણ્યહોષવિવરણ નામનો અંથ ધર્ણી રીતે ઉપયોગી છે. એક તો પુષ્ટિમાર્ગ વિષે લોકોમાં જોટી સમજણુ કેલાયું છે તે કેટલેક ફરજને આ અંથને લીધે હૂર થવાનો સંભવ છે. વળો હાલના વખતમાં કામની-વિષયની વૃદ્ધિ થવા માંડી છે તો તેની સામે ધર્મ પોતાનો અવાજ ઉઠાવે તો કંઈ અયોગ્ય નથી.

પહેલાં આપણું જીવન સરક અને સાહું હતું. લોગ સામાજી ધર્ણીજ થાડી અને જીજ અરચથી પુરી પડે એવી હતી:

(૫)

આજકાલ જીવન કૃતિમ થતું જય છે અને લોગ સામચ્રી ક્રાંતિના મારતી વધતી જય છે. એને પાશ્ચાત્ય ખુદ્ધિએ શોધી કાઢેલા અને પુરા પાડેલા પહોંચો પુષ્ટિ આપતા જય છે. મોહથી અંનાઈ જાનું ને લોગ સામચ્રીના પહોંચો ધર્મદૃષ્ટિથી અહૃણુ કરવા ચોગ્યા કે નથી એનો વિચાર કરવાની તકનો પણ લાલ લીધા સિવાય તે અહૃણુ કરવામાં આવે છે. એકનું જોઈ બીજે તે પ્રમાણુ કરે છે. સ્વતંત્રતાના ભિષથી આપણે ઉગડે ઉગડે પરતંત્ર થતા જધુએ છીએ. સહુન કરવાની શક્તિ એઠો થતી જય છે. અનેક પ્રકારે કામ અને લોગ વધે છે. એવા અમયમાં આવા અંથ ઉપયોગી થવાને: સંભવ છે.

આ અંથ સુમજાવવા માટે પર્વિતશ્રી લાડલોશજીને: અને સૂચનાએ માટે રા. રા. શાસ્ત્ર! મગનલાલ ગણપતરા-મનો અમે આભાર માનોએ હીએ.

નડીઓ ૧૦૮ ૧-૩-૦૮

ખીજ આગુત્તિની પ્રસ્તાવના.

ધર્મ, અર્�, કામ, અને મોક્ષ એ ચાર પુરુષાર્થો કહેવાય છે, એમાં જે કામ કહેલો છે તેને! અર્થ સુખ અથવા આત્મસુખ થાય છે. મન સાત્ત્વિક થતાં જ્યારે લૈંડિક વિષયો સંખાંધી તમામ છુંછાયો ફૂર થાય છે ત્યારે તેમાં જે સુખનો પ્રતીતિ થાય છે તેને કામ કહે છે. એ કામ પુરુષાર્થિઝપ હોઈ સર્વ ગ્રંથે હશ્ય છે. પણ આ વ્યંથમાંતો કામ શાળદ વિષયજન્ય સુખના અર્થમાં વાપર્યો છે અને તે પુરુષાર્થ ઝપ નથી, કેમકે વિષયજન્ય કામ સર્વ પ્રાણીઓને સાધારણ છે તેથી તે પુરુષાર્થ હોઈ શકે નહિ.

બૃદ્ધાભિવન, નાડિયાદ.
ક્રીનાંદ્રાલ જ્યાંત.
૧. સન તા. ૫ મ ૧૯૧૦. }
—

ગોસ્વામી શ્રીહરિરાયજીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર.

કામાખ્યદોષવિવરણ નામના ગ્રંથના અને ખીંડા અનેક લઘુ અંથોના રચનાર શ્રીમહ ગોસ્વામી શ્રી હરિરાયજી શ્રીકલ્યાણરાયજી ના જન્મેષ પુત્ર હતા. એમના પિતા શ્રીકલ્યાણરાયજી શ્રીઆચાર્યજી મહાપ્રભુજીના પુત્ર શ્રીવિઠુલનાથજી (શ્રીગુસાંધજી) ના દ્વિતીય પુત્ર શ્રીગોવિંહરાયજીના પુત્ર હતા. શ્રીહરિરાયજીને જન્મ સંવત् ૧૬૪૭ના લાદ્રપહ કૃષ્ણ પના રોજ થયો હતો. એમના નાના ભાઈનું નામ શ્રીગોપેશરજી હતું. શ્રીહરિરાયજીને શ્રીગુસાંધજીના ચોથા પુત્ર શ્રીવિઠુલ અથવા શ્રીગોકુળનાથજીએ પ્રફાસંખંધ હીક્ષા આપી હતી.

શ્રીહરિરાયજીના જીવનચરિત્ર વિષે ધર્ણી હકીકત હાલ જાગુવામાં નથી. પરંતુ એમણે ૩૦૦થી ૫૦૦ સુધી લઘુઅંથો રચ્યા છે એ વાત સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. એ લઘુઅંથો ઉપરાંત એમણે વાહના અંથો લગ્યા હોય એમ જણાય છે. એમના અંથો ઉપરથી એમ અનુમાન થાય છે કે એમણે પ્રમાણું કરતાં પ્રમેય ઉપર ધર્ણોભાર મુક્યો છે. હૈન્ય અને શ્રીનિલાચાર્ય ઉપર સંપૂર્ણ આસક્તિ એ એમના લઘુઅંથોનું લક્ષણ છે. એમના અંથો પૈકી કેટલાકને છે એમણે પાતાનું નામ હરિદાસ લણ્યું છે. એમના તમામ અંથો શ્રીઆચાર્યજીમહાપ્રભુજીના અંથો ઉપર વિવરણ દ્વારે છે. એમના લઘુઅંથો પૈકી ૧૧૪ અંથો ૭૦૯૫સ્તોત્ર સરિતસાગરના દ્વિતીય ભાગમાં છાપાયા છે, અને ખીંડતો હજુ અપ્રસિદ્ધજ છે. એ તમામ અંથો ઉપયોગી છે. એ પૈકી થોડાનાં નામ વાંચનારના ઉપયોગને માટે અમે નીચે આપીએ છીએ.

જન્મ વૈફલ્યનિરૂપણાષ્કરમ्, દૈન્યાષ્કરમ्, વિજાસિ, પુષ્ટિમાર્ગ લક્ષણાનિ, સ્વમાર્ગમૂલરૂપનિરૂપણ, સર્વાત્મભાવનિરૂપણમ्, ભક્તાનાંદુ:સંગવિજ્ઞાનપ્રકારનિરૂપણ, ૬૦

શ્રીહરિરાયજુએ શ્રીઆચાર્યજી મહાપ્રભુજીની બેઠકેની સારી સંભાળ લીધી હતી એમ જગ્યાથ છે, તે કારણુથી કેટલીદુષ્પદ્ધ બેઠકેની સાથે શ્રી આચાર્યજીના નામની સાથે એમનું નામ પણ જોડાયલું સંભળવામાં આવે છે.

श्रीकृष्णाय नमः

॥ अथ कामारूपदोषविवरणम् ॥

दोषेषु प्रथमः कामो विविच्य विनिरूप्यते ॥

यस्मिन्नुत्पद्यते तस्य नाशकः सर्वथा मतः ॥ ? ॥

अर्थ—(सर्व प्रकारना) होषेभां काम ए प्रथम होष છે. तेनुं विवेचन करीने पूर्ण रीते निरूपणु करवाभां आવे છે. ए होष ज्वेभां उत्पन्न थाय છે तेनो ते नाश करે છે एम सर्व प्रकारे भानवाभां आवेलुં છે.

विवेचन—काम केंध, लोल, मोह, मद, मत्सर, एम अनेक होषो છે तेभां काम ए प्रथम होष કહेवाय છે.

काम शब्दनो साधारण अर्थ હુંचा છે. ते स्त्रीना समागमनां उत्कट હુંचा, व्यलिचार वगेरे ३६ अर्थभां वपराय છે. आ आओ अंथ वांचतां मालभ पडे છે के एमां काम ए ११८ स्त्रीना समागमनी उत्कट હુંचा, व्यलिचार तेमજ झीज विषयोनो હુંचा वगेरे अर्थभां वापरवाभां आવयो છે.

आ अंथनुं नाम “ कामारूपहोषविवरणु ” છે. विवरणु एट्वे टीका, खुलासो, विशेष रीते करवाभां आवेलुं वर्णन. ए उपरथी जणुओ કे वे होष कामना नामथी ओणभाय છે ते होषथी उत्पन्न थता परिणामोनुं आ अंथभां संपूर्ण रीते वर्णन करवाभां आवयुં છે.

कामने भूलभां प्रथम होष एटला माटे कहेलो છે के तेनो जन्म, केंध, लोल, मोह वगेरे तेनां लांडुओना पेडेलो थायछે. अताशुभां कडुं छે के:-

વિષયોનું ધ્યાન કરનાર પુરુષને તે વિષયોમાં સાંગ ઉપજે છે. સાંગને લીધે તે વિષયો પ્રાપુ કરવાની કામના (કામ) અથવા ધૂચા ઉત્પત્ત થાય છે. એ કામ અથવા ધૂચા ઝર્ણાભૂત કરવાના કામમાં જે વિનિરૂપ માલમ પડે છે તેના ઉપર કોધ ઉત્પત્ત થાય છે. કોધ ઉત્પત્ત થતાં કર્તવ્યાકર્તવ્યનો વિવેક જતો રહે છે અને તેથી સંમોહ થાય છે. મોહ પેઢા થતાં શાસ્ત્રોએ કરેલા ઉપહેશની સમૃતિ (યાદ્યાદસ્ત) નો નાશ થાય છે, અને ધર્માધર્મ ગતાવનાર સમૃનિનો નાશ થતાં, સહભુદ્વિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થતાં જેની અંદર કામ ઉત્પન્ત થયો હોય તેનો નાશ થાય છે એટલા માટે મૂળમાં કામને નાશક કહેવો છે.

કામ એ રંજેશુણુમાંથી ઉત્પત્ત થાય છે. તે ઉપર ખતાંયા પ્રમાણે બુદ્ધિનો અંગ્રેજી જ્ઞાનનો નાશ કરે છે. માંજ ભગવાન ગીતાલુમાં કહે છે કે:-

તસ્પાત્રમિદ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્પથ ।

પાપ્માનं પ્રજાહિદેનં જ્ઞાનવિજ્ઞાનનાશનમ् ॥

3. ૩૧-૪૧

અર્થ—હે ભરત કુળમાં શ્રેષ્ઠ અર્જુન ! એટલા માટે તું પ્રથમ દંનિદ્રિયોને નિયમમાં લાવીને સર્વ પાપના મૂળભૂત અને જ્ઞાન અને વિજ્ઞાનના નાશ કરનાર આ (કામ) ને નિર્ધય હણુ.

વિષયાવેશહેતુત્વાદ્વિક્ષેપોત્પત્તિકારણમ् ॥

રજોગુણ સમુત્પત્તો રજઃ પ્રક્ષેપકો મુખે ॥ ૨ ॥

અર્થઃ—તેનું (કામનું) મૂલ વિષયાવેશ હોવાથી તે વિક્ષેપની ઉત્પત્તિનું કારણ છે. તે રંજેશુણુમાંથી ઉત્પન્ત થયો છે, અને મોંમાં ધૂળ નાખવે છે.

વિવેચન—જે મનુષ્ય વિષયોનું ચિંતન કરે છે તેના મન માં તે વિષય પ્રાપુ કરવાની ધૂચા થાય છે, માટે કામનું મૂળ વિષયાવેશ છે એમ કહેવામાં આવ્યું છે.

દે વિષય (પરાથ) સારો લાગે તે પ્રાત કરવાની મનમાં પ્રથમ કૃચ્છા ઉત્પન્ન થાય રોને વિષયાવેશ કરે છે. મન જ્યારે અમુક વિષય ઉપર વળે લારે એ કરતાં વધારે સારી વસ્તુ ઉપર જેવી રીતે તે ચાંટવું જોણે તેવી રીતે ન ચાંટે એ હોખીતુંજ છે.

વિક્ષેપ એટલે ચિત્તની અસ્થિરતા, અને તેથી ઉત્પન્ન થતાં વિધન, પ્રતિગંધ વળોરે. અમુક પહોર્યોની પ્રાતિની કૃચ્છા ઉત્પન્ન થતાં તે કૃચ્છા ભગવત્કાર્યમાં વિધનરૂપ નિવારે એને વિક્ષેપ કરેવામાં આવે છે.

સત્ત્વ, રજુ અને તમ એ ગુણ ગુણુ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે. તે જગતમાં સર્વત્ર ઠેકાણે વ્યાપી રહેલા છે. એ ગુણો હેઠમાં રહેલા અવ્યય જીવાત્માને બંધન કરે છે (૧૪. ૩૧. ૫). એ ગુણો પૈકી સત્ત્વ ગુણ નિર્મણ, પ્રકાશક, અને હુઃખથી રહિત હોવાથી જીવાત્માને સુખ અને જ્ઞાનના સંગવડે બંધન કરે છે (૧૪. ૩૧. ૬). આ હેઠમાં સર્વ કંદ્રિયોમાં જ્યારે જ્ઞાનરૂપ પ્રકાશ ઉત્પન્ન થાય છે ત્યારે સત્ત્વ ગુણ વિશેપ વયેલો છે એમ આણુંબું (૧૪૩૧. ૧૧). મરણ સમયે જેનામાં સત્ત્વ ગુણની વૃદ્ધિ થઈ હોય તે ઉત્તમ લોકને પ્રાત થાય છે (૧૪. ૩૧. ૧૪). સાત્ત્વિક કર્મનું ઝાળ સાત્ત્વિક અને નિર્મણ છે (૧૪. ૩૧. ૧૬). સત્ત્વગુણથી જ્ઞાન ઉત્પન્ન થાય છે (૧૪. ૩૧. ૧૭). સત્ત્વગુણવાળો ઉત્તમ લોકને પામે છે (૧૪. ૩૧. ૧૮).

રબેગુણ તૃપ્તણા અને સંગની ઉત્પત્તિ કરે છે. તે રાગરૂપ છે. તે જીવાત્માને કર્મના સંગવડે બંધન કરે છે (૧૪. ૩૧. ૭). રબેગુણ કર્મમાં જોડે છે (૧૪. ૩૧. ૯). રબેગુણની વિશેપ વૃદ્ધિ થયેલોભ, પ્રવૃત્તિ, કર્માનો આરંભ, અશાંતિ, અને કૃચ્છા ઉત્પન્ન થાય છે (૧૪. ૩૧. ૧૨). ભરતી વખતે જેનામાં રબેગુણની વૃદ્ધિ થયેલી જોવામાં આવતી હોય તે મનુષ્યલોકમાં જન્મ પામે છે (૧૪. ૩૧. ૧૫). રાજ્ય કર્મનું ઝાળ હુઃખરૂપ

હોય છે (૧૪ ગી. ૧૬). રણેગુણુથી લોલજ ઉત્પન્ન થાય છે (૧૪ ગી. ૧૭).

તમોગુણુ અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. તે સર્વે પ્રાર્ણુઓમાં મોહુ ઉત્પન્ન કરી પ્રમાદ, આળાસ અને નિદ્રાવડે તેમને બંધન કરે છે (૧૪ ગી. ૮). તમોગુણુ જ્ઞાનને ટાંકી હાને પ્રમાદમાંજ લેડે છે. (૧૪ ગી. ૯). તમોગુણુની વિશેપ વૃદ્ધિ થયે અપ્રકાશ, અપ્રવૃત્તિ, પ્રમાદ અને મોહુ ઉત્પન્ન થાય છે. (૧૪ ગી. ૧૩). મરતી વખતે જેનામાં તમોગુણુની વૃદ્ધિ થયેલી જણુતી હોય તે મૂહ ચેનિમાં જન્મ પામે છે. (૧૪ ગી. ૧૫). તામસકર્મનું ઝળ અજ્ઞાન હે (૧૪ ગી. ૧૫). તમોગુણુથી પ્રમાદ, મોહુ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે. (૧૪ ગી. ૧૭). તમોગુણુની વૃત્તિ-માં રહેલાં પ્રાર્ણુઓ નીચ ગતિને પામે છે. (૧૪ ગી. ૧૮)

કામના સંબંધમાં રણેગુણ કર્ચા અને અશાનિત ઉત્પન્ન કરે છે. એ અશાનિતને લોધે મુખનો પ્રાહુલ્લાલ થતો નથી એવ-કુંજ નહિ પણ તે અનેક અયોગ્ય કર્મ કરાવે છે. અયોગ્ય કર્મ કરવાથી આગુરુ ઓછી થાય છે માટેજ રણેગુણુથી ઉત્પન્ન થયેલો કામ મુખમાં ધુળ નાખનાર કહેલો છે.

ब्रह्मवेशविरोधी च सद्बुद्धर्वाधको मतः ॥
सत्कर्मनाशकः सर्वप्राकृतासक्तिसाधकः ॥ ३ ॥

અર્થ:—(કામ) એ પ્રજ્ઞાના આવેશનો શરૂ છે, અને તે અહખુદ્ધિની સ્કુરણું થવામાં બાધકરૂપ માનવામાં આવે છે. તે સત્કર્મનો નાશ કરે છે, અને સર્વે પ્રાકૃત લैાક્ષિકાસક્તિને ઉત્તેજન આપે છે.

વિવેચન—જોટલે દરજાને લैાક્ષિક વિષયોમાં મન પરોવાયેલું રહે તેઠલે દરજાને અલૈાક્ષિક વિષય—ખ્રાં અથવા ભગવાન्-માં મન નાજ રહે એ હોયીતું છે. કામનો વિષય લैાક્ષિક પદાર્થ હુાવાથી અને તે લैાક્ષિક પદ્ધતિમાં મન વારંવાર શુંથાયદું

રહેવાથી ભગવાનમાં મન રહેજ નહિં. એટલા મારે કામને ભગવાનના આવેશનો શાશ્વત અથવા વિરોધી ગણેલો છે. શ્રીમદ્બાયાર્થ-ચરણું પણ ‘સંન્યાસનિર્ણય’ નામના અંથમાં કહે છે કે વિષયા કાંતદેહાનાં નાવેશાઃ સર્વદા હરેઃ અર્થાત् જેએના શરીરમાં વિષય આપી ગયો છે તેએને શ્રીઝિનો આવેશ થવાનો બીલકુલ અંભવ નથી.

કામી પુરુષને સહખુદ્ધિ પણ હોતી નથી. કામાવેશ એ રાજસગુણનું કાર્ય હોવાથી જે સહખુદ્ધિની નિર્ણયાસક્રિત કે-સેવામાં જરૂર છે તે સહખુદ્ધિને કામાવેશ પ્રતિખંધરૂપ નિવડે છે. સહખુદ્ધિના અભાવે કામી પુરુષ સત્કર્મનો નાશ કરનાર નીવડે છે. સત્કર્મ એવું હથિ સેવા, પ્રભુને પ્રસન્ન કરે એવાં કર્મો, પ્રભુ પરાયણ કર્મો. કામી પુરુષોથી આવાં કર્મો થઈ શકતાં નથી, નેથી તેમને એવાં કર્મોનો નાશ કરનાર કહેલા છે.

પુષ્ટિ સૃષ્ટિનું પ્રાકટ્ય ભક્તિપ્રચારાર્થ છે, પ્રાકૃતઆસક્રિત સાધવાને નથી. કામથી તો પ્રાકૃતઆસક્રિત સાધવાનું મન થાય છે, એવું અપ્રાકૃત ભગવહાસક્રિત સિદ્ધ કરવામાં કામ બાધક છે.

આખા १લોકમાં સત્ત અસત્તનો વિવેક ખતાવી અસત્ત કામથી ચિત્તનો રોધ કરી સત્ત શ્રી કૃષ્ણમાં ચિત્તને ચોજવું એમ નાર્પય છે.

ચિત્તાશુદ્ધિનિર્દાનત્વાત् ચિદુત્તપત્તૌ ચ બાધકઃ ॥
ભક્તિમાર્ગમહાદ્વૈષણ વૈરાગ્યભાવસાધનાત् ॥ ૪ ॥

અર્થઃ—કામનું મૂળ કારણ ચિત્તની અશુદ્ધ હોવાથી નિરૂપાધિક ચૈતન્યની ઉત્પત્તિમાં તે ખાધકરૂપ છે. તે વૈરાગ્યના અભાવનું સાધન હોવાથી ભક્તિમાર્ગનો મહાદ્વૈષણ (શાશ્વત) છે.

વિવેચન—આ १લોકના પૂર્વાધીમાં શ્રીકૃષ્ણનું ચિત્ત સ્વરૂપ.

નિરૂપણ કરી કામનું અચિતત્વ સ્પષ્ટ કરે છે. પુષ્ટિઅક્ષિતમાં ભગવતું પ્રાકદ્વયજ પરમદૂળ છે. એમ કાષ્ટમંથનથી કાષ્ટાંતરગત અચિત પ્રકર થાય છે તેમ વિપ્રયોગાનિદ્રારા ઈદ્રિયાદિ મંથનથી હૃદયાંતરગત પ્રભુનો પ્રાહુર્લાલ થાય છે. પ્રભુના પ્રાહુર્લાલમાં વિપ્રયોગાનિદ્રારા શુદ્ધ હૃદયની અપેક્ષા છે. કામીનું હૃદય કામથી માલન હોય છે. અશુદ્ધ ચિત્તમાં તેનો અધિહેવતા વાસુહેવનેજ તિરોભાવ, તો પછી ભગવદ્પ્રાહુર્લાલનો પ્રસંગજ કયાં ? કામનો જન્મ ચિત્તની અશુદ્ધમાંથી થાય છે. ચિત્ત શુદ્ધ થવાને માટે ભગવતુકથા-ભગવદ્વાર્તાનું નિત્ય શ્રવણ મનન વિગેરેથી ભગવાનમાં નિત્ય ચિત્ત પરોવાએદું રાખવું. તમામ લૈાંકિક અંગો કિક કાર્યો ભગવાનને અર્પણું કરવાં, શુદ્ધ મને ભગવાનને અર્પણું કરેલા પદ થોનુંજ લોજનમાં સેવન કરવું, તથા શાન્તિ આદિ સહગુણોનું સેવન વિગેરે કિયાએથીજ ચિત્તની શુદ્ધિ થાય છે. આ કિયાએ જે નિત્ય કરતો નથી તેનું ચિત્ત અશુદ્ધ રહે છે, અને તેમ થવાથી તેમાં કામ વિગેરે અનેજ વિકારી પ્રવેશ કરે છે. તેથી ઉપાધિરહિત શ્રીહરિનું ચિંતન થાં રાકૃતું નથી.

કામને વૈલબ્યની અપેક્ષા હોવાથી તે વૈરાગ્યનો નાશ કરે છે. “વિષય તૃપ્ણા રહિતપણું” એવૈરાગ્ય એમ શ્રીમદ્ભાગ્યાયોજુ આજા કરે છે. પોતાનું સુખ વિચારે ત્યાં સુધી હરિલક્ષ્મિ થઈ રહે નહીં માટે કામીને લક્ષ્મિનો દેવી કહેલો છે.

લક્ષ્મિમાર્ગમાં વૈરાગ્યની ખાસ જરૂર છે, કેમકે તેમાં તમામ લૈાંકિક પદાર્થો ઉપરથી ચિત્તને એંચી લઈ માત્ર ભગવાન ઉપરજ રનેહ કરવાની જરૂર છે. એટલાજ માટે શ્રીમદ્ભાગ્યાયોજુ પંચક્ષેપાંકિમાં કહે છે:- અનુકૂલસ્ય સંકલપ: પ્રતિકૂલબિસર્જનમ્
અર્થાત ભગવતું પ્રામણમાં અનુકૂલવષયની સારી કલ્પના કરવી,
એટલે ભગવતું સેવામાં સર્વ વસ્તુનો વિનિયોગ કરવો, અને
અતિકૂલ વસ્તુનો ત્યાગ કરવો. (વધારે ખુલ્લાને માટે શ્રી વહુલ-
ચરિત્ર પૃષ્ઠ ૧૮૨—૧૮૩ બ્લેઝાં).

पूर्वोक्त वैराग्य विना लक्षित संलवती नथी, कामीने पूर्वोक्त वैराग्य होतो नथी एवेक्षे कामीने लक्षितशत्रु गणेशो छ. कामीनुं मलिन चित्त विषयमां होय छे एवेक्षे तेनाथी हुरि से वा अनती नथी. अन्य स्थगे श्रीहस्तिरायलु कुहे छे क्यः—

चित्तदोषे कथं सेवा चेतस्तप्त्वणं भवेत् ॥

शिक्षापत्र ३०-१३

अर्थः—चित्तमां होष होय त्यां चित्तना तत्प्रवणुइप सेवा शीरीते होय, अथोत् ज्यां सुधी चित्तनी शुद्धि थाहु नथी, अने कामकेधाहि तेमांथा अस्यां नथी, त्यां सुधी लगवाननी चित्त प्रोपवाइप सेवा अना शक्ती नथी.

सर्वत्रापरितोषश्वानेन लोभसमुद्भवात् ॥

यथाकर्थंचित्तसांमुख्योद्विय वैमुख्यकारकः ॥ ६ ॥

अर्थः—काममांथी लोभनी उत्पत्ति थवाथी तेने लीघे सर्वत्र असंतोष प्रसरे छे, अने लेभ तेम करीने धृद्रियो लगवत् स-मुख थाहु होय तो ए लोभ धृद्रियोने लगवानथी विमुख करी हे छे.

विवेचन—मनमां कामवासना उत्पन्न थतां ए वासनाने संतोषवाने द्रव्यनां जड़े पडे छे ए जड़े पुरी पाठवा लोभ उत्पन्न थाय छे.

लेभ काम मननी साम्यावस्थानो नाश करे छे तेम लोभ पणु मननी साम्यावस्थानो नाश करे छे. ते करणुथी लोभी मनुष्य अमुकु कर्म कर्तव्य छे कु नहि एनो विवेक करी शक्तो नथी.

मनमां लोभनो उद्भव थतां सर्वत्र ठेकाणे अपरितोष (असंतोष) इसाय छे. मनमां असंतोष थतां मुख्य धृद्रियो मन, अक्षु वज्रे लगवानथी विमुख थाहु जाय छे, केमके लोभी माणु-

सने एवी शांति क्यांथी होय के ए भगवान् संभंधी विचार
करे, के भगवत्कथा वाता वाचे के सांलणे.

पुष्टिभक्तिमार्गमां तनुज वितज्ज सेवा करवाथी मा-
नसीसेवा सिद्ध थाय छे. वैश्वदेव न होवाथी तननी के मन-
नी सेवा न संलवें, पण वितज्ज सेवा संलवे एम उपन्ता क-
राय तो ते पणु अर्थ छे. काममांथी लोल प्रकट थाय छे. लोल
थये। के अपरितोष थाय छे अने अपरितोष थतां वितज्ज सेवा
करवामां प्रभुनु द्रव्य प्रभुने समर्पवामां ऐह थाय छे, एटले
था तथा उन्द्रिय भगवत्सन्मुख थक्क होय तो पाठी विमुख
थए जय छे.

कामलोभाँ हरिप्राप्तिबंधकपर्वता ॥

तावुलुंश्य न शक्नाति गंतुं कृष्णांतिकं जनः ॥ ६ ॥

अर्थः—श्रीहरिनी प्राप्ति थवामां काम अने लोल ए ए
प्रतिभंध करनारा पर्वतो छे. ए पर्वतोने ओणगीने श्रीकृष्णनी
साक्षिध्यमां जवाने मनुष्य शक्तिवान् थतो नथी, ६

कैषपणु स्थणे पहेंचवानो मार्ग शीघ्रो, सरण अने प्रति
अंध विनानो होय तो ते उपरनुं प्रयाणु स्फेदार्थी थक्क शके
अने ज्ञे स्थणे ते मार्ग लेक्क जतो होय ते स्थणे साधारणु
माणुसथी पहेंची शकाय. पण रस्तो आदा जैयावाणो, अने
ठाण टेकरावाणो होय तो वधारे श्रम पडे, अने ते रस्तो कापवो
मुश्केल पडे. वणी ते उपरांत रस्तामां नही नाणा के केतर
आवतां होय तो तेथी पण वधारे शक्तिवान्ज ते रस्ते प्रयाणु
उरी शके, अने ज्ञे रस्तामां पर्वतो आवता होय तो तो साधा-
रणु माणुस माटे ते पर्वतो ओणगी तेनी खीलु आज्ञाएजवानुं
अशक्यज्ज घने.

श्री हरिरायलु क्षेष्ठे छे के भगवत्प्राप्तिना मार्गमां काम
अने लोल ए झेगा पर्वतो वचमां आवे छे. काम अहुंता-

વધેંક છે, અને કામજન્યલોલ મમતાવર્ધક છે. અહુંતા અને મમતા એ બંને લક્ષિતમાં પ્રતિબંધક છે, એટલે કામીને લક્ષિતમાર્ગ પરવડે નહિ. જેઓને લગ્વપત્રપ્રાપ્તિની હૃદ્યા હોય તેઓએ કામ અને લોલ બંનેને મનમાંથી ફર કરવા જોઈએ.

જ્યાં સુધી મનમાં કામ અને લોલ રહ્યા હોય ત્યાં સુધી લગ્વપત્રપ્રાપ્તિની આશા કરવી એ કેવળ વ્યર્થ છે.

અન્યસ્થળે શ્રી હરિશાયજી કહે છે કે:—

કામાવિષ્ટે કોધયુતે સંસારાસક્તિસંયુતે
લોભાડભિભૂતે સતત ધનાર્જનપરાયણે ॥

શિક્ષાપત્ર ૩૨. ૧.

અર્થ:—જે કામથી આવિષ્ટ છે, કોધયુક્ત છે, સંસારમાં આસક્તિ રાખવાવાળો છે; જે નિરંતર ધન લેણું કરવામાં તત્પર છે (એના હૃદયમાં શ્રી હરિ કહો પણ પ્રવેશ કરતા નથી).

સંસાર મોહહેતુત્વાત् મનોદૂષણસાધનમ्
અતઃસેવાવિરોધી ચ યતઃ સા માનસી મતાઃ ॥૭॥

અર્થ—તે (કામ) સંસારમાં મોહ ઉત્પત્ત કરતા હોવાથી મનને ફૂષણુવાળું કરવાનું સાધન થાય છે, અને તેથી કરીને તે લગ્વપત્રસેવામાં વિરોધી છે, કેમકે સેવા એ મનનો વિષય માનેલો છે. ૭

વિવેચન—મનમાં કામનો પ્રવેશ થતાં સંસારને વિષે મોહ ઉત્પત્ત થાય છે. મોહ ઉત્પત્ત થતાં મન ફૂષણુવાળું થાય છે, અર્થાત् તેની નિર્મણતાનો અને તેના પાંગનો નાશ થાય છે. શ્રીમહાચાર્યચરણું સિદ્ધાન્તમુક્તાવલિમાં લગ્વપત્રપ્રાપ્તિને માટે સહેલામાં સહેલો ઉપાય સેવા ખતાવે છે. ચેતસ્તત્પ્રવણ સેવા એટલે શ્રી હરિમાં ચિત્ત પરોવવું એને સેવા કહે છે. જે ચિત્તમાં કામનો પ્રવેશ થયો હોય તે ચિત્ત શ્રી હરિમાં પ્રવેશ કરી શકતું નથી, કેમકે કામે તેમાં પ્રવેશ કરવાની રહિત હરી લીધેલો

હોય છે. જેના હાથ પગ લાગેલા હોય તે માણુસ કેમ ચાલી કે કામ કરી શકતો નથી તેમ કે મન કામ, કોધ, મોહાદિથી દ્વારા વિષિત થયેલું હોય તે મન ભગવાનમાં પ્રવેશ કરી શકતું નથી.

સેવા એ માનસીપ્રયોગ છે. શ્રીહરિમાં પ્રવેશ કરવાને દ્વારા વિષિત મન અશક્તિવાન् હોવાથી કામ અને તેના અનુયાયીઓને સેવાના વિરોધી કહેવામાં આવ્યા છે.

અન્ય સ્થળે શ્રીહરિરાયજી કહે છે કે,

સ્પર્ત્નબ્યઃ સર્વદા કૃષ્ણો વિસ્પર્ત્નબ્યં જગત્ પુનઃ ॥

પ્રપંચસ્પરણે કૃષ્ણસ્મृતિ નૈવભવોદિતિ ॥

શિક્ષાપત્ર ૩૦-૧.

અર્થઃ—સર્વદા શ્રીકૃષ્ણ સ્મરણ કરવા યોગ્ય છે, અને જગત્ વિસ્મરણ કરવા યોગ્ય છે. જ્યાંસુધી પ્રપંચનું સ્મરણ હોય ત્યાંસુધી શ્રીકૃષ્ણની સ્મૃતિ હોય શકે નહિ.

નિરોધસ્ય મહાઙ્ગુરુન્યસ્ફૂર્તિકરો યતઃ ॥

ગુણગાનસપત્નોऽપિ ન રોचંતે ગુણા યતઃ ॥ ૮ ॥

અર્થઃ—કામ એ નિરોધનો મહાન् શત્રુ છે કેમકે તેનાથી અનેક પ્રકારની વૃત્તિઓનું સફૂરણ થાય છે. શ્રી હરિના ગુણ ગાનનો પણ તે શત્રુ છે અને તેથી કરીને તેને (કાભીપુરુષને), શ્રી હરિના ગુણનું ગાન ઇચ્છતું નથી. ૮

વિવેચન—નિરોધલક્ષણ નામના શ્રીમહાચાર્યજીએ રચેલા ગ્રંથ ઉપરથી જણાય છે કે (જુઓ શ્રી વાલ્મીયરિત્ર) શ્રી હરિના ગુણ ગાવામાં નિરંતર મનને રોકવું અને તમામ જ્ઞાનેન્દ્રિયો, કર્મન્દ્રિયો, મન અને હેઠના સર્વ વ્યાપાર ભગવાન પરતવેજ રાખવા, એનું નામ નિરોધ છે. કામ એ આવા પ્રકારના નિરોધનો શત્રુ છે, કેમકે તેને ભગવાનના ગુણ ગાનની સ્કુલ્તિ થતી નથી પણ અન્ય વિષયોની સ્કુલ્તિ થાય છે.

કામી મતુથ્ય તો નિરંતર પોતાના કામના વિષયનું, તેમાં જોઈની સામચ્રી અને સાધનોનુંજ ગાન કરે છે. આવા કનિષ્ઠ પ્રકારનાં શુણુગાનમાં ગુંથાયહું મન શ્રીહરિના શુણુગાનમાં પ્રવેશ કરી દકેજ નહીં. એટલા માટે કામને નિરોધનો મહાન् શક્તિ કહેલો છે. ખીને શોક્ય ન બમે તેમ કામને પ્રભુના શુણુગાનઃપી નિરોધ ગમતો નથી, અને તેજ કારણથી તેમાં એને ઝચિ ઉત્પન્ન થતી નથી.

નિરોધ એટલે માનસીસેવા. પ્રપંચવિસ્મૃતિપૂર્વક લગ્વદાસક્રિયા એજ નિરોધ છે. પ્રપંચવિસ્મૃતિ એ નિરોધનું પૂર્વ અંગ છે. કામીને પ્રપંચની વિસ્મૃતિ ન હોય. લગ્વદાસક્રિયા એ નિરોધનું ઉત્તર અંગ છે. શુણુગાન વિના લગ્વદાસક્રિયા થતી નથી. કામી કામ્યપહાર્થના શુણુગાનમાં ઉન્મત્ત હોય છે; તો તે શ્રીહરિનું શુણુગાન કયાંથી કરે ?

વैરाग्यसाधકાઃ સર्वे કામિનસ્તે કથંપ્રિયાઃ ॥

અત એવ હિ દૃશ્યંતે શુણશ્રવણવૈરિણઃ ॥ ૧. ॥

અર્થ:-ઉપર કહેલા શ્રી લગ્વાનના સર્વશુણો વैરાગ્ય ઉત્પન્ન કરવાના સાધનઙ્ય છે, તેથી કરીને શ્રી હરિના શુણોનું ગાન કામીપુરુષને કેમ પ્રિય લાગે ? એ પ્રમાણે હોવાથી કામી પુરુષો લગ્વાનના શુણુશ્રવણને વિષે દુઃમન હોય એવા જણાયછે.

વિવેચન-શ્રી હરિનું શુણુગાન કરવાનો મુખ્ય હેતુ તમામ લોકિક પદાર્થો ઉપરથી મનને ખસેડી માત્ર શ્રીહરિના ઉપર તેને ચોટાડવું એ છે, એમ કરવાનો ધણો મહાવરો થવાથી પ્રભુ ઉપર સ્નેહ ઉત્પન્ન થાય છે અને તે સ્નેહ (રાગવિનાશઃ) રાગને તોડનાર હોવાથી પ્રભુમાં આસક્રિય ઉત્પન્ન કરી (ગૃહારુચિઃ) ધર્મી પુત્ર વળોરે ને વિષે અર્દચિ પેઢા કરે છે, અર્થાત્ વैરાગ્ય ઉત્પન્ન કરે છે (જુઓ લક્ષ્મિવર્ધિની શ્લોક ૪). એ ઉપરથી જણાશે કે પ્રભુના શુણુગાનથી વैરાગ્ય ઉત્પન્ન થાય છે, પરંતુ

કામી મનુષ્યને તમામ મનોવ્યાપાર એ સધળા લैંકિક પહાર્યો
ઉપર પ્રીતિની વૃદ્ધિ કરવાના હેતુવાળો હોવાથી તે પ્રભુના ગુણ
શ્રવણને શરૂ કોવામાં આવે છે.

સારાંશ એ છે કે અગ્રવિગુણગાન કરવામાં આવે તો અગ-
વાન પ્રપંચરાગના વૈરી હોવાથી વૈરાગ્ય સિદ્ધ કરી હે છે, પણ
કામીને તો વૈરાગ્ય વિષતુદ્ય છે માટે કામીને અગ્રવિગુણ કેમ
પ્રિય હોઈ શકે ? તે કારણથી કામીને ગુણ શ્રવણના વૈરી કહે-
વામાં આવે છે.

કોધःસ્વકાર્યકરણાલોભः પ્રાપ્ત્યાપિ શામ્યતિ ॥

ઘૃતહોમે વાહિરિવ કામો ભોગેન વર્ધતે ॥ ૧૦ ॥

અર્થ:-—પોતે ધારેલું કાર્ય સિદ્ધ થયેથી કોધ શાન્ત થાય
છે. ધૃતિદ્વારા પહાર્થ પ્રાપ્ત થયેથી લોલની શાન્તિ થાય છે, પરંતુ
દી હોમવાથી જેમ અનિન વૃદ્ધિને પામે તેમ કામ લોગથી
વૃદ્ધિને પામે છે. ૧૦

વિવેચન—અમુક માણુસ અમુક રીતે વર્તતો ન હોય તે
કારણથી આપણુને તેના ઉપર કોધ થાય તો તે કોધ તે માણુસ
આપણા ધાર્યા પ્રમાણે વત્યેથી ઉત્તરી જાય છે. આપણુને અમુક
પહાર્થ જોઈતો હોય, અને કોઈ માણુસ આપણુને તે પહાર્થ લેવા
હોતો ન હોય તેથી આપણે તેના ઉપર ગુસ્સે થઇએ, પણ એ
ગુસ્સો એ પહાર્થ આપણુને લેવા હીધાથી ઉત્તરી જાય છે.

જે કારણથી કોધ ઉત્પન્ન થયો હોય તે કારણ હુર થતાં
કોધની શાન્તિ થાય છે, એજ પ્રમાણે લોલનું પણ છે, પરંતુ
કામની ખાખતમાં તેમ થતું નથી.

અનિનમાં દી હોમવાથી અનિન વધારે પ્રદીપ થાય છે.
તેવીજ રીતે જેમ જેમ કામ તૃપ્ત કરવામાં કે લોગવવામાં આવે
છે તેમ તેમ તે વૃદ્ધિને પામે છે. એ કારણને લીધે લોલ અને
કોધના કરતાં કામને પ્રભુપ્રાપ્તિના વિષયમાં વધારે ખળવાન
શરૂ ગણવામાં આવે છે.

કામેન નાશિતમતિઃ પ્રતિષિદ્ધે પ્રવર્તતે ।
અગમ્યાગમને ચૌર્યે તથૈવાભક્ષયભક્ષણે ॥૧૧॥

અર્થ:—કામથી હુણુયલી બુદ્ધિ શાસ્ત્રોએ નિષિદ્ધ કરેલા કર્મામાં, અગ્રયગમન, ચારી અને અલક્ષ્યભક્ષણમાં પ્રવર્તે છે.

વિવેચન—કામથી બુદ્ધિ શીરીતે હુણુાઈ જય છે તે પૂર્વે પહેલા શ્લોક નીચેના વિવેચનમાં સમજવવામાં આવ્યું છે. એ હુણુાઈ ગયેલી બુદ્ધિ સારી અને શાસ્ત્રવિહિત કર્મામાં ઇચ્છિવાળી હોતી નથી, પણ શાસ્ત્રોએ મના કરેલાં કર્મામાં જોડાય છે. એવી બુદ્ધિવાળો કામીમાણુસ ક્રેચોની સાથેનો આડો વ્યવહાર શાસ્ત્રોએ તેમજ ઉત્તમ લોકિક નીતિ વ્યવહારે નિષેધ કરેલો છે તેચોની સાથે સમાગમ કરવાને અસ્તકો નથી. પાતાની પાશવ વાસનાઓને સંતોષવા કામી ચારી, ઠગાઈ, તેમજ અલક્ષ્ય (ન ખાવા લાયક વસ્તુ) નું લક્ષણ કરે છે.

લક્ષણી બુદ્ધિ અપ્રતિષિદ્ધ પદાર્થ તરફ વળે છે. લગ્વ-
-મંહિરાદીજ લક્ષણાં ગંતવ્યસ્થાન છે. લક્ષણ ચૌર્યાદિ હોષથી
રહિત હોય છે, અને લગ્વત્સમર્પિત પદાર્થનું લક્ષણ કરે છે.
કામીને આ ચારે પાલવતાં નથી.

યત ઉત્પદ્યતે કોધો મહદ્દોહસમુદ્ભવः ।
લોભોऽપિ જાયતે તસ્માત् સ ચાર્થવિષયો ભવેત् ॥૧૨॥

અર્થ:—કામમાંથી કોધ ઉત્પદ્ય થાય છે, અને તેથી ગ્રહાની સાથે વિરોધ પેદા થાય છે, કામમાંથી લોલ પણ ઉત્પદ્ય
થાય છે, અને અર્થ અથવા દ્રવ્ય એ લોલનો વિષય થાય છે.

વિવેચન—કામને લીધે બુદ્ધિ હીન થતાં કામી માણુસ પુચ્છિત વિષયની યોગ્યાયોગ્યતા તપાસ્તી શકુતો નથી, અને
તેથી મોટા માણુસો સાથે વૈર થાય છે. કેટલીક વખત ચાકર,
ખવાસ કે નોકરને પાતાના અજહાતાની કેછી સર્ગી સ્વી તરફ

હુમ્મતિ ઉત્પજ્ઞ થતાં વિરોધ ઉત્પજ્ઞ થાય છે, અને એ વિરોધનું પરિણામ વખતે મોતમાં આવે છે. કામ પૂર્ણ કરવાનાં સાહિત્યો પ્રાપ્ત કરવામાં દ્રોધ મહદગાર થઈ પડે છે, તેથી કામ-માંથી દ્રોધ પ્રાપ્ત કરવા રૂપ લોકની ઉત્પત્તિ થાય છે. ચોગ્ય માર્ગે દ્રોધ પ્રાપ્ત કરવાને કામી માણુસ અશક્ત હોય છે ત્યારે તે પ્રાપ્ત કરવાને તે ગમે તેવાં અચોગ્ય કર્મો કરવાને અચક્તો નથી.

કામને લીધે રહેઠા પુરુષો સાથે વૈર ઉત્પત્ત થયાના હ-
નારો હાખલા પુરાણો અને ધતિહાસો ઉપરથી મળી આવે છે.
એ બાખતનો જથાખંધ પુરાવો ઝેઝદારી અદાલતો હરહુમેશ
પુરો પાડુ છે.

દ્રોયમાં કેટલા અનર્થ રહેતા છે તે નીચેના શ્લોકથી પા-
તાવવામાં આવે છે.

सोऽर्थः पञ्चदशानर्थमूलं तत्र प्रवर्तते ।

कामेनैव हि कार्पण्यं कामिनीषु सतां मतम् ॥? ३॥

અર્�ઃ—તે અર્થ (ક્રિય) (નીચે જગ્ણાવેદા) પંદર અનર્થનો
મૂળાઙ્કપ હોવાથી સર્વ અનર્થો કામો પુરુષમાં પ્રવેશ કરે છે.
કામને લીધે કામનીઓ પરતવે કામીપુરુષને દીનતા (કાર્યક્રમ)
પ્રાપું થાય છે એમ નહેટા પુરુષોએ માનેલું છે.

स्तेयं हिंसानृतं दंभः कापः ऋधः स्मयो मदः ।

धेदो वैरमविश्वासः संस्पर्धा व्यसनानिच ॥

અર્�:—૧ સ્તોય (ચારી), ૨ લિંસા, ૩ અનૃત (જુદું
બોલવું), ૪ દંસ (ડોળ), ૫ કામ, ૬ કોધ. ૭ સમય (ગર્વ)
< મદ, < લેદ, ૧૦ વૈર, ૧૧ અવિશ્વાસ, ૧૨ સંસપ્રધાં (હૃદ્યા)
૧૩ સુરત, ૧૪ ધૂત ૧૫ મધ.

વિવેચન:- વ્યક્તનો માં ચુરત, ધૂત અને ભધનો સમાસ થાયછે.

ઉપર કહેલા પંદર અનથો દ્રોયમાં રહેલા હોવાથી કામી-
પુડુષોમાં એ સર્વ અનથો પ્રવેશ કરે છે.

કામીમનુષ્યો કે સીને વિષે આસ્કૃતવાળા હોય છે તે કીએ પરતે દાસોડહં નવાસિમ (હું તારો દાસ છું) એ પ્રમાણે રહે છે. કામને લીધે તેઓનામાં એટલી ખધી હીનતા (કાર્પણ્ય) વ્યાપી ગઈ હોય છે કે રખેને મને આ સી છોડી હેશો કે તે નારાજ થશો અને તેથી મહારા વિલાસમાં ખલેલ પડશો, એ ભયથી તેઓ. કીએની અપમાનકારક વાણી અને વર્તાણુંક મુંગે મોઢે સહન કરે છે.

કામમાંથી લોલ ઉત્પન્ન થાય છે, અને લોલ અર્થવિષયક છે એમ પૂર્વે કહેવામાં આવ્યું છે. હુવે અર્થના સ્વરૂપનો વિચાર કરતાં નિશ્ચય થાય છે કે અર્થ એજ અનર્થ રૂપ છે.

મોટા મોટા ભગવણીયોનો પણ કામે નાશ કરી નાંગ્યો એ સ્પષ્ટ કરી તેના પ્રાણદયનું હુવે નિરૂપણ કરવામાં આવે છે.

પ્રાર્થયંતિ યતસ્તુચ્છાં પ્રવેશ્ય વદને કરમ
પ્રિયવ્રતસુતો રાજા ભ્રષ્ટ: કામેન સત્ફલાતુ ॥ ૧૪ ॥

આગ્નીધ્રો વિષયાવેશાદુર્વર્ણીલોકમાપિતઃ ॥

કામેન કશ્યપો દૈત્યોત્પાદને હેતુતાં ગતઃ ॥ ૧૫ ॥

નિવૃત્તસંધ્યાનિયમ: પત્નિપ્રાર્થનમોહિતઃ ॥

કામેન ચ શિવઃ કૃષ્ણયુવતીરૂપવાંચિતઃ ॥ ૧૬ ॥

અર્થ:—કામને લીધે કામી લોકો તુચ્છ કીએનાં મોંમાં આંગળી ધાલી તેમની પ્રાર્થના કરે છે. કામને લીધે પ્રિયવ્રત રાજનો પુત્ર આગ્નીધ ભગવત્પ્રાપ્તિરૂપ સત્રલથી ભ્રષ્ટ થયો હતો. અને તેને વિષયાવેશ હોવાથી તે ઉર્વશીના લોકને પામ્યો હતો. કશ્યપ પ્રજાપતિ કે સંધ્યાની ડિયાઓથી પરવાયા હતા તે પોતાની પત્નિની પ્રાર્થનાથી મોહિત થઈને કામને લીધે હૈત્યાની (ડિરણ્યાક્ષ અને ડિરણ્યકશિપુની) ઉત્પત્તિના કારણું જૂત થયા હતા. તેમજ કામને લીધે શ્રીમહારૂપજી શ્રીકૃષ્ણના મોહિની સ્વરૂપથી મોહ પામીને છેતરાયા હતા.

વિવેચનઃ—કામને લીધે કામી મનુષ્યો હીન થઈ પોતાની મોહમૂર્તિ મય તુચ્છ અથવા હલકી સ્વાચ્છાને મહેંમાં તરણું ઘાલી કરગરે છે; અર્થાત् તેમને ખુશી રાખવાને પોતે પોતાનાં માન, આખરું, પદવી, કર્તાંય તમામને ભૂકી જઈ માત્ર તેમની ભરળું સંપાદન કરવાની ખાતર તેમની ખુશામત કરે છે. કામને અભાવે ને સ્વીચ્છા હિંદુકુલ માન આપવાને પાત્ર ન હોય એવી હલકી નિર્લંઘ અને ખ્રષ્ટ સ્વીચ્છા પ્રત્યે કામી મનુષ્યોની આવી ભક્તિ થઈ જવાથી તેમનાં ઐહિક અને પારસૈાહિક કંચાણુંનો સર્વ પ્રકારે નાશ થાય છે.

કામની સત્તા માત્ર રેણુપેણુ માણુંસો ઉપર ચાલે છે એમ નથી, પણ તે મહાત્માઓ અને દેવોના ઉપર પણ ચાલે છે એમ અતાવવા શ્રી હરિરાયજુ પૌરાણિક દષ્ટાન્તો આપે છે.

આણનીધરાણઃ—આણનીધરાણ પ્રિયત્રતનો પુત્ર હતો. તે ધર્મ તરફ દૃષ્ટિ રાખીને જંબુદ્વિપની પ્રણનું પેટની પ્રણ પેઠે પાલન કરતો હતો. તેને ક્રાદ્ધિક હિવસે પુત્રની છુચ્છા થઈ, તેથી તે મંહરાચલની ગુફામાં ગયો અને ત્યાં પ્રણપતિયોના પતિ લગવાન् પ્રદ્ધાનું તપક્ષીર્યાવડે આરાધન કરવા મંડયો. એ તપક્ષીર્યા જોઇને પ્રદ્ધાનું પૂર્વચિત્તિ નામની અસરાને તેની પાસે મોકલ્યા. તેના નૂરુરનો મનોહર અણુકાર સાંલળી આણનીધરની સમાધિ છુટી ગઈ. તે અસરાનાં આનંદપ્રદ ગતિ, વિહાર, લબ્જા, વિનયપૂર્વક દૃક્ષણ (જોવું), મધુર ભાષણ અને શરીરના સુંદર અભિનય (લટકાં) આ સર્વ કામોદોપક હતાં. આવી મનોહારી અસરાને જોઇ આણનીધરાણએ તેને આધીન થઈ જઈ કહ્યું કે:—હું તમોને અનુકૂળ થયો છું માટે તમારું મન હોય ત્યાં ભલે મને લેઈ જાઓ અને તમારી સખીઓ પણ મને અનુકૂળ થાયો તથા હરિણીઓ જમણી તરફ ઉત્તરે.

બુદ્ધિ, શીલ, રૂપ, વૈવન, લક્ષ્મી અને ઉદ્ધારતાથી આ-

કિસુ મનવાળી પૂર્વચિત્તિ અસરા તે મહા શૂરવીર આંની-
ધરાણની સાથે રહીને હુલારો વર્ષ સુધી પૃથ્વી તથા સ્વર્ગના
લોગ લોગવવા લાગ્યો. રાજ આંનીએ એ ખોને વિશે નાલિ
વગેરે નવ પુત્રો ઉત્પન્ન કર્યા. એ નવ પુત્રોને રાજનાજ ધરમાં
મુકીદઈ પૂર્વચિત્તિ પાછી બ્રહ્માની પાસે ગઈ. આંનીધરાણ કા-
મનો ઉપલોગ કર્યા છતાં તૃપુ થયો નહોંતો, અને પ્રતિહિન તે
અસરાનેજ આંધક માનતો હતો. તેથી તે વેદોકુલ કર્મો કરીને
અસરાના લોકમાંજ ગયો. આ કથા શ્રીમહાલાગવતના પંચમ
સ્કંધના ખીજી અધ્યાયમાં છે.

બ્રહ્મા રન્નેગુણ્ણી હોવાથી આંનીધરાણને રન્નેગુણ્ણુથી ઉત્પન્ન
થયેલા કામની પ્રાપ્તિ થઈ. એ વાત ઉપરથી જાણું જોઈએ કે
રન્નેગુણ્ણી બ્રહ્મા કે તમોગુણુપ્રધાન ઝડની ઉપાસના ભગવત-
પ્રાપ્તિના કાર્યમાં યોગ્ય નથી, પણ નિર્ણયું શ્રી કૃષ્ણ પરમાત્મા-
નીજ ઉપાસના કર્તાં છે.

કશ્યપઋપિની કથા:—કશ્યપઋપિ મરીચિદ્ધિના પુત્ર હતા.
એ પ્રભાપતિઓમાંના એક હતા. એ દક્ષ પ્રભાપતિની તેર દીક-
રીએ વેરે પરણ્યા હતા. આ તેર પેકીની એક દિતિ હતી.
એક દિવસે સંતાનની દુઃખવાળાં અને કામથી પીડાયલાં દિતિ
યજશાળામાં એકાશચિત્તથી એઠેલા પોતાના ભર્તા કશ્યપની
પાસે જઈ કહેવા લાગ્યાં કે હે વિદ્ધન! મહોન્મત્ત હાથી જેમ
કેળને બળાત્કારથી પીડે તેમજ આ કામહેવ હાથમાં ધનુષ લેઈ
પોતાનું પરાક્રમ પ્રકટ કરીને તમારે માર્યે મને હીનને ખડુજ
પીડે છે. માર્યે હે નાથ, પુત્રવાળી શોકયોની સંપત્તિથી બળો
મરતી એવી જે હું તેના ઉપર આપ અનુશ્રહ કરો, અને તમારું
કદ્યાણ થાઓ. જે ખોયોને પતિના તરફથી ખડુજ માન મળે
છે, તથા તપસ્વી મુનિઓ જે ખોયોમાંથી પ્રભાદ્રે ઉત્પન્ન
થાય છે તે ખોયોનો યશ લોકોમાં ફેલાય છે. માર્યે મારી
કામના પૂર્ણ કરો. આ પ્રમાણે કામની વૃદ્ધિથી મોહિત થયેલી

કૃપણ દ્વિતીનો તે નિષિદ્ધ કર્મમાં આગ્રહ જાણીને કશ્યપજ્ઞાનીએ આવી હૈવને પ્રાણુભ કરી દ્વિતીની મનકામના પૂર્ણ કરી. પછી ટનાન કરી પ્રાણુયાભ કરી, મૈન ધારણ કરી તે ઋષિ શુદ્ધ સતતમૂર્તિ એવા જ્યોતિર્મય પ્રહૃતુ ધ્યાન કરતા ગાયત્રીનો જ્યુપ કરવા લાગ્યા. લાર પછી દ્વિતિ પોતાનાં નિહિત કર્મથી લબધ ગયાં અને પોતાનાં પતિની પાસે આવી આ પ્રમાણે કહેવા લાગ્યાં:—

હુ પ્રહૃત ! મેં નેનો અપરાધ કર્યો છે તે ઝ્રદ્રહેવ સર્વ પ્રાણીઓના પતિ છે. તે ભૂતોના સ્વામી મહાહેવ આ મારા ગર્ભનો નાશ કરશો મા. નિર્હય પુરુષોના ઉપર હ્યા કરવા ચોગ્ય શાંકર અમો સ્વી જ્ઞાતિ ઉપર પ્રસન્ન થાઓ.

સાયંકાળના નિયમને પૂર્ણ કરીને કશ્યપજ્ઞાની એવ્યાઃ “હુ કર્દ્યાણી ! હુ કોધી સ્વી ! તારા મનના અપવિત્રપણુને લીધે, સંધ્યાકાળરૂપી હુષ સમયને લીધે, મારી આજા ઉદ્દલંઘન કરવાને લીધે, અને ઝ્રદ્રના સેવકેનો અપરાધ કરવાને લીધે તારા ઉદરમાં અધમ તથા હુષ એ પુત્ર ઉત્પન્ન થશો અને ભૂતોક સહિત આ ત્રણે લોકને વારંવાર હુઅી કરશો, અને જ્યારે ધર્મા જુલમ થશો ત્યારે અગવાન અવતાર ધારણ કરી તારા પુત્રોનો નાશ કરશો.”

તે પછી કેટલેક કાળે હિરણ્યકશિપુ એ એ હૈત્યોને દ્વિતીએ જન્મ આપ્યો. (ભાગવત સ્કંધ ૩. અધ્યાય ૧૪ થી ૧૭)

એ પ્રમાણે કામને લીધે કશ્યપજ્ઞાની પણ હૈત્યોરૂપી અ. નિષ પરંપરાની ઉત્પત્તિના કારણુભૂત થયા હતા.

શ્રી મહાહેવજીની કથા:—શ્રીહરિએ સૌના ઝ્રથી હૈત્યોને માહિત કરી હૈવોને અમૃત પાયું. આ વાત સાંલળીને જ્યાં અગવાન બિરાજતા હતા લ્યાં આગળ તેમનું સ્વરૂપ જેવા માટે

મહાદેવ પાર્વતી સાથે નંદીશર ઉપર બેચી પોતાના પાર્ષ્વદોષી વિટળાધુને ગયા. લગવાને શાંકરનો તથા પાર્વતીનો આદર સાથે સત્કાર કર્યો. શાંકરે પણ સારી રીતે બેઠા પછી લગવાનનો સામે સત્કાર કર્યો, અને મંદમંહ હુસતાં નીચે પ્રમાણે કહ્યું:—
 “હે દેવના દેવ ! હે જગતુ વ્યાપક ! હે જગતના સ્વામિ !
 હે જગતમય ! તમે સર્વ પદાર્થીના આત્મારૂપ છો, કારણુરૂપ છો, અને ઈશ્વર છો. જગતમાં જે આદિ, અંત અને મધ્ય છે તે તમારામાં નથી. દૃશ્ય-દૃષ્ટા અને લોભ્ય-લોકૃતા જેનાથી જીવાં નથી તે સત્ય અને ચૈતન્યઘન પરખ્યા આપ છો. મોક્ષની ઈચ્છા-વાળા મુનિઓ નિષ્કામ થઇને આ લોકની તથા પરદોકની આસક્તા છોડી તમારાજ ચરણારવિદ્ધની ઉપાસના કરે છે. તમે પરપૂર્ણાંછો, સર્વ સુખરૂપાંછો, ગુણરહિતાંછો તેથી શોક વિનાના છો, અને તેથીજ વિકાર વિનાના છો, આનંદસ્વરૂપ છો, સર્વ સ્વરૂપ છો, અને સર્વથી લિપ્ત એવા પરખ્યા છો, તથાપિ આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનાર છો. જીવાને જીવાં જીવાં ફરા આપનાર છો. તમારે કોઈની પણ અપેક્ષા નથી. પરંતુ જીવાને તમારી અપેક્ષા છે; મારે તમારે જે ઈશ્વર્ય છે તે ભક્તોના અનુશ્રહને મારે છે પણ તમારે પોતાને મારે નથી. કુંડળ કડાંતા આકારમાં બનેલું સોનું, તથા વિશેષ આકાર વિનાનું સોનું એ અન્ને જેમ એકજ છે તેમજ કાર્ય-કારણરૂપ હૈત તથા તેનું પરમ કારણ તમે એકજ છો. ગુણોવડે અનેક લીલા કરનાર આપના ખીંચ અવતારો મેં જોયા છે. હવે આપે જે મોહિની સ્વરૂપ ધર્યું હતું તે સ્વરૂપ જોવાની ઈચ્છાથી અમે આવ્યાં છીએ, કારણ કે અમને તે સ્વરૂપ જોવાની અત્યંત ઉત્કંઢા છે.”

આ પ્રમાણે શાંકરે લગવાન વિષણુની પ્રાર્થના કરી એટલે લગવાન લાવવડે ગંભીરતાથી હુસીને શાંકર પ્રત્યે કહેવા લાગ્યા:— જીવારે હૈત્યો અમૃતકલશ લેઈ ગયા ત્યારે દેવતાઓનાં કાર્ય કરનારા મેં, હૈત્યોને મોહિત કરવા મારે, સ્વીતું રૂપ ધારણ કર્યું

હતું. હે દેવ એપણ ! તે સ્વરૂપ કે જે કામિયો અહુ ઉત્તમ માને છે અને જેમાંથી કામની ઉત્પત્તિ થાય છે તે મોહિનીરૂપ તમે જોવાની ધૂર્ઘાવાળા છો તો તમને કું હેખાડું છું.”

આ પ્રમાણે કહેતાંવાર ભગવાન લ્યાંજ અહૃત્ય થઈ ગયા અને શાંકર ઉમાની સાથે ચારે તરફ દિશા કરતા એસી રહ્યા. એટલામાં શાંકરે લ્યાં આગળ એક વિચિત્ર જાતના પુણ્યોવાળાં તથા નવપત્રીઓ રાતાં પાંદડાંવાળાં વૃક્ષોનું એક ઉપવન દીનું અને તે ઉપવનમાં ફડાની રમત રમતી એક સુંદર સ્વીને દીઠી. તે જમણું હાથથી ફડાને ઉછાળતી હતી અને પોતાની લીલાથી જગતને મોહિત કરતી હતી. લાબણ્યમયી, મનોહારી એ રમણીને સિમતહૃત્ય કરતી, અને હૃદભ-વેંધક કટાક્ષો મારતી જોઈને શાંકર તેના ઉપર મોહિત થઈ ગયા. તેણું શાંકરના વિવેકનો નાશ કર્યો. તેથી કામથી વિહૃવન એવા શાંકર પાર્વતીના હેખતાંજ લ્યાંજ મૂકીને તેની પાછળ હોડ્યા. એ પ્રમાણે શ્રી મહાહેવળ પણું કામથી પરાજ્ય પાખ્યા હતા.

કામેન નારદઃ ષष્ઠિપુત્રાનજનયત્સ્વતઃ

ગર્વાભાવાય હરિણ દત્તઃ કામો મહાશનઃ ॥ ૧૭

અર્થઃ—કામથી હોરાદુને નારદજીએ પોતાના શરીરથી સાહ પુત્રો ઉત્પન્ન કર્યા હતા. શ્રી હરિણે મનુષ્યનો ગર્વ ઉતારવાને મારે તેમના પાછળ સર્વલક્ષી કામને મુક્યો છે.

વિવેચન—શ્રી નારદજીને ગર્વ થયો કે મારા સમાન કોઈ ભગવહલક્તા નથી. એમના ગર્વનું નિવારણ કરવા શ્રી હરિણે મહાશન કામ નારદજીમાં મુક્યો. કામને વિવશ થઈ નારદજીએ ૬૦ પુત્રોને જન્મ આપ્યો.

માણુસને ગર્વ ન રહે એને મારે પ્રલુબે કામને મુક્યો છે.

ગર્વ (અહુંકાર, દર્શ) ઉતારવાને કામજ સખળ છે, કારણુંકે કામીને કામ્યવિષય કે વ્યક્તિની અપેક્ષા (પરવા) રહે

છે, અને તેથી તેના આગળ તેનો ગર્વ ગળો જાય છે. જે માણુસને કામવાસના હોય નહિ તો, તેને કશાની અપેક્ષા નહિ રહેવાથી તેનો નિરપેક્ષ ગર્વ નિરંતર વધ્યાંજ કરે. એ કારણુથી શ્રી હરિરાયજી કહે છે કે કામ એ ગર્વ ટાળવાને મારે છે.

કામેન ભરતસ્યાપિ હરિણત્વં ભવાંતરે ॥

પુરંજનોડપિકામેન સ્ત્રીયોનિમુપલબ્ધવાન् ॥ ૧૮ ॥

અર્થ:—કામને લીધે (આસક્તિને લીધે) ભરતજીને પણ ખીજ જન્મમાં હરણુના હેઠની પ્રાપ્ત થઈ હતી, અને કામથી (વિષયવાસનાથી) પુરંજન રાજને પણ સ્ત્રીનો અવતાર પ્રાપ્ત થયો હતો.

વિવેચન—પુરંજન રાજ ખીમાં ઘણેં લોલાયો હતો તેથી એને સ્ત્રીનો અવતાર ધારણ કરવો પડ્યો હતો.

ભરતજીની વાર્તા—એક દિવસે ભરતજી શારીરિક ડિયાઓથી પાણેંચી ગંડકી નહીને કાંઠે નિત્ય નિયમથી પરવારી ઊँકારનો જપ કરતા એઠા હતા, એટલામાં સામે કાઠેથી વાધની ખીકથી ઢેકેલી એક મૃગલીનો ગલ્લ નહીમાં પડતો અને તણાતો તેમણે હીઠો. તે ઉપરથી તેમણે દ્વારા આર્દ્ધ થઈ તે મૃગલીના તરતના જન્મેલા બચ્ચાને પાણીમાંથી કાઢી લીધું, અને પછીથી તેનું પાલણ પોષણ તેમણે કરવા માંડયું, અને તેમની ઘણી આસક્તિ ખંધાઈ ગઈ, અને તે આસક્તિ એટલી પ્રથમ થઈ કે તે પોતાનું જપ અને ધર્મદિયાઓ બુઝ્યા, અને તેથી કરીને તેમને એક પામર મનુષ્યની પેઠે મૃગનો અવતાર આપ્યો. (શ્રીમહુ ભાગવત સ્કું. ૫-અધ્યાય ૮.)

કામેન વૈદગભોડપિ સ્વસુતાયાં તથાકરોત् ॥

તેનૈવ રાવણો બુદ્ધે રમાયામન્યથાકરોત् ॥ ૧૯ ॥

અર્થ:—કામથી બ્રહ્માલુને પણ પોતાની પુત્રી સરસ્વતીને

જવષ [વિષયભાવના થઈ હતી, અને તેજ કામને લીધે રાવણુની પણ સીતાલુ પ્રત્યે વિપરીત બુદ્ધિ થઈ હતી.

વિવેચનઃ—દાંકાના રાજ રાવણે શ્રી રામચંદ્રજીની સતી સીતાલુનું હરણ કીધું હતું અને તેમાં તેણે વિષયબુદ્ધિ રાખી તેથી તેના પરિણામે તે અને તેનું આખું કુદુંખ નાશ પાડ્યું હતું. આ કથા શ્રી રામાયણ નામના મહાકાવ્યમાં સુપ્રસિદ્ધ છે.

અદ્ધાની કથા—જગતના પિતા અદ્ધાની અધર્મથી ભ્રષ્ટ થયેલી બુદ્ધિને લીધે કામના વેગને ન રોકતાં તેને આધીન થઇને દ્વારાદૃષ્ટિથી પુત્રો સરસ્વતી પ્રત્યે જવા ઇપી કૃતિનું આખ્યાન પણ કામની સંગળતા સાખીત કરે છે. (શ્રીમહ લાગ્વત સ્ક્રી. ૩ અધ્યાય ૨૨).

એવં હિ બહોનષ્ટાઃ કામેનैવ હિ સાધવઃ

ભક્તિમાર્ગે વિરોધસ્તુ તત્ત્વ કામઃ કૃતો મહાન् ॥ ૨૦ ॥

અર્થઃ—એવી રીતે ધણુા ધણુા સાધુ પુરુષો કામને લીધે ખુલાર થયેલા છે. વળી લક્ષ્મિમાર્ગને વિષે પણ તે કામનો સંખંધ મહા વિરોધી અથવા શત્રુરૂપ છે.

વિવેચનઃ—ઉપર કે દાખલાઓ આચ્યા તે ઉપરથી જણુા શે કે કામથી ધણુા સાધુ પુરુષો નાના થયા છે. લક્ષ્મિમાર્ગને વિષે તો કામનો સંખંધ મહા શત્રુરૂપ ગણ્યાય છે. લક્ષ્મિનાં મુખ્ય વણું અંગ છે. ૧ પ્રલુના માહાત્મ્ય જ્ઞાનની પ્રાપ્તિ, ૨ પ્રલુ ઉપર સર્વથી અધિક સ્નેહ રાખવો તે, અને ૩ પ્રલુમાં નિરંતર ચિત્તને પરૈવવું તે. આ ત્રણે અંગોને કામ અંડિત કરે છે.

કોઈ કામ્ય વસ્તુ પ્રાપ્ત કરવાની મનમાં પ્રખળ પુઢ્યા ઉત્પન્ન થવાની સાથે પ્રલુનું માહાત્મ્યજ્ઞાન સંપાદન કરવાને, કથા, વાર્તા, વાંચન, લેખન વગેરે પ્રકારે કે વખત ગાળવામાં આવતો હાય, તે વખત એ વસ્તુ પ્રાપ્ત કરવામાં વાપરવાને મન લદયાયા વગર રહેતું નથી.

કામ્ય વિષયરૂપ કે વસ્તુ હોય તે વસ્તુ પ્રાપ્ત કરવાની જેટલે દરજને પ્રીતિ થાય, તેટલે દરજને લગવાનું પ્રત્યેની પ્રીતિમાં ન્યૂનતા થયા વગર રહેતી નથી.

જેટલે દરજને કામ્ય વિષયરૂપ વસ્તુ પ્રાપ્ત કરવામાં ચિત્ત રાખવામાં આવે તેટલે દરજને લગવાનમાં ચિત્તની એકાશ્રતા કરવાનું અની આવતું નથી.

એ રીતે કામ સર્વ પ્રકારે લક્ષિતને વિષે શત્રુરૂપ નીવાંછે.

કામિનः ફલવાંछાતः શરणं નैવ સિદ્ધ્યતિ ।

સાપેક્ષસ્થતુ સર્વત્ર દુર્લભમં હિ સમર્પણમ् ॥ ૨૧ ॥

તદ્ભાવે તદીયત્વં સર્વથૈવ હિ દુર્લભમ् ।

સાધારણ્યેવ બુદ્ધિઃ સ્યાતેન લીલાસ્થિતેષ્વપિ ॥૨૨॥

અર્થ—કામીપુરુષને ઝળની ધૂચિંઠા હોવાથી તેને શ્રીહરિનું શરણ સિદ્ધ થતું નથી; કેમકે ઝળની અપેક્ષાવાળાને શ્રીહરિને વિષે સમર્પણું કરવાની બુદ્ધિ થવી એ સર્વ પ્રકારે દુર્લભાંછે. ૨૧

સમર્પણુને અભાવે લગવદીયપણું સર્વ પ્રકારે દુર્લભ છે. કામને લાઘે લગવાનની લીલામાં રહેલા લક્તાજનોના સંખાંધમાં સાધારણું લૈાકિક બુદ્ધિ થાય છે. ૨૨

વિવેચન—કામીપુરુષને ઝલની ધૂચિંઠા હોય છે. એ ધૂચિંઠા એટલી અધી પ્રથમ હોય છે કે એ ધૂચિંઠાવાળા મનુષ્ય એ કામનાજ વિષયને પોતાની નજર આગળ નિરંતર હેઠે છે; તે કારણુથી એના મનની તમામ વૃત્તિઓનો એ વિષયમાંજ નિરોધ થાય છે. એ પ્રમાણે જેનું મન વિષયમાંજ ગુંથાયદું હોય તે શ્રી હરિનું શરણું શી રીતે પ્રાપ્ત કરી શકે?

શ્રીહરિનું શરણું પ્રાપ્ત કરવામાં સર્વ વસ્તુઓ શ્રી હરિને સમર્પણું કરવાની છે, એટલુંજ નહિ પણ શરીર, ધનિદ્રાઓ અને મનના તમામ વ્યાપાર પ્રલુનોજ અર્પણું કરવાની જરૂર છે. જ્યાં સુધી સર્વ વસ્તુઓ લગવાનને સમર્પણ ન કરી હોય ત્યાં સુધી

પ્રભુનુજ્ઞ શરણુ, પ્રભુનો આશ્રમ થઈ શકતો નથી. જ્યાં સુધી એમનો આશ્રમ સિદ્ધ ન થાય ત્યાં સુધી એમની પ્રાપ્તિ પણ થઈ શકે નહિ.

સમર્પણથીજ લગવદીયપણું પ્રાપ્ત થાય છે.

મનમાં જ્યાં સુધી કામવાસના હોય ત્યાં સુધી લગવાની લીલામાં રહેતા જીવોના સંખારમાં મનુષ્યને લૈાંકિક બુદ્ધિ થયા વગર રહેતી નથી. જ્યારે જ્યારે શ્રી હરિની લીલા વિષેનો કથા વાર્તા તેઓ વાંચે કે સાંભળે ત્યારે ત્યારે એમના મનમાં એમ વિચાર ઉત્પન્ન થાય કે લગવાન એ એક મહા રાજી કામીપુરુષ છે, એમનો કામ અનિવાર્ય છે, તે કહી પણ તુમ થતો નથી; આવા વિચારો કામીપુરુષોની રીતભાત ઉપરથી કામીમનમાં ઉત્પન્ત થયા વગર રહેતા નથી. એ વિચાર કરતી વખતે તેઓ ભૂલી જાય છે કે, લગવાનનું લગવાનપણું નિષ્કામતા કે વૈરાગ્ય ઉપર આધાર રાખે છે. જે છે લગ અથવા ઐંશ્વર્યને લોધે પ્રભુને લગવાન કહેવામાં આવે છે તે, ૧ ઐંશ્વર્ય, ૨ વીર્ય, ૩ ચશ, ૪ શ્રી, ૫ જાન અને ૬ વૈરાગ્ય છે. સતત વૈરાગ્ય ધારણું કરવાવાળા લગવાનને કામવાસના હોંકજ શકે નહિ, તો એમની લીલામાં એનો ગંધ કે નૃપર્શ ડાવાનો સંભવ નથી.

જે જીવો પ્રભુનીજ સેવામાં નિરંતર ગુંથાઈ રહે છે તેઓ પણ લૈાંકિક વિષયની વાસનાવાળા છે એમ લોકો ધારે છે અને તેમના ઉપર અનેક ઝોટા આરોપો મુકે છે. નૃસિંહ મેહેતો, ભીરાંખાઈ વગેરે અનેક લક્ષ્મનનોના ઉપર અનેક પ્રકારના આરોપ મુકવામાં આવતા એ વાત સુપ્રસિદ્ધ છે. દ્વયવહ્નારમાં પણ એમજ જોવામાં આવે છે.

કામલેન યથા પીતપતીતિરલિલે ભવેત !

પંચાધ્યાય્યામતઃ શ્રોત્રં હૃદોગત્વં શુકૈરપિ ॥ ૨૩ ॥

दोषहुऽस्मिः कायिनस्तु भवेष्टीलाकृतौ हरेः ।

निवंधे श्रीपदाचार्यैरत इंद्रियानेग्रहे ॥ २४ ॥

अत्यागः सर्वथा प्रोक्तो भगवद्वक्तिसाधकः ।

कौतुकार्थ्यपि त्यागो धर्मार्थयपि वर्जितः ॥ २५ ॥

अर्थः—જે પ્રમાણે કુમળાના રાગવાળાને સર્વ વસ્તુમાં
પીળા રંગના પ્રતીતિ થાય તે પ્રમાણે ભગવદ્લીલાના સંખંધમાં
પણ કામને લીધે તેવી ભાવના અથવા પ્રાકૃત બુદ્ધિ થાય છે,
તેથી કરીને રાસપંચાધ્યાયીમાં પણ શુકૃહેવળુંએ કામ ને મનનો
રાગ કહેલો છે. ૨૩

શ્રીહરિની લીલાના કુતિમાં કામીપુરુષોને હોષણુદ્ધિજ થાય
છે, અને તેથી શ્રીમહ વદ્ધલાચાર્યજીએ નિખંધના અંથમાં કુ-
નિદ્રયના નિશ્ચહનો સર્વથા અત્યાગ કહ્યો છે, એવે ધનિદ્રયોનો
સર્વથા નિશ્ચહ કરવાનો કહેલો છે, કેમકે ધનિદ્રયનિશ્ચહ ભગવદ્-
ભક્તિનો સાધક છે. વળી શ્રી આચાર્યચરણ કરીથી કહે છે કે કુ
નિદ્રયનિશ્ચહનો ત્યાગ કોતુકને અથે પણ કરવો નહિ, તેમજ
ધર્મના અર્થમાં પણ ધનિદ્રયનિશ્ચહનો ત્યાગ કરવો નહિ. ૨૪-૨૫.

વિવિચન.—જે માણુસને કુમળો થયો હોય તે સર્વ વસ્તુને
પીળી હોયે છે એજ પ્રમાણે કામી મનુષ્યો ભગવાનુંની લીલાને
કામરૂપ હોયે છે એ મોટી ભૂલ છે.

જે અનંત કેટિ અણાંડોને રચે છે, જે સર્વ પ્રાણીઓના
આત્મા છે, જે સર્વ પ્રાણીમાત્રના માતા પિતા છે તે કામી
હતા અને હોષણુકતા કામીપુરુષો તરીકે વર્ત્યો હતા એ કહેવું
અયોગ્ય છે.

ભગવાનુંની અપ્રાકૃત લીલાઓનો ખરો અર્થ એમના કુપા-
પાત્ર ભકૃતોજ સમજવી શકે છે. એ લીલાઓ સંખંધી પ્રાકૃત
બુદ્ધિ કરવી અધિત છે.

ભગવાન् શ્રી કૃષ્ણની આસુરહમન, વાનરણ, રાસલીલાદિ

લીલાચોનું પરમ રહુસ્ય જાણવા માટે શ્રીમહાચાર્યજી "વહુલાચા-
ર્થજીજીત ભગવત ઉપરનાં "સુષોધિની" ટીકા અથવા તે
આધારે (પ્રસિદ્ધકર્તાએ ગુજરાતીમાં રચેલાં) "કૃષ્ણ લીલા-
મૃત" જોવાં.

કામ એ માત્ર શરીરનોજ રોગ નથી પણ મનનો એ રોગ
છે, કેમકે કામીપુર્ખો ખીંબને પણ તેવી ભાવનાવાળા જીએ છે
અને ભગવાનની શુદ્ધ લીલામાં પણ તેવી ભાવના જેળવે છે
માટે શુકૃદેવજી એને હૃદયનો રોગ કહે છે.

શ્રીમહાચાર્યજી નિગંધના સર્વનિર્ણય પ્રકરણમાં કહે છે કુ-

સ્વર્ધમાચરણ શક્તયા વિધર્માચ્ચ નિર્વત્તનમ् ॥

ઇંદ્રિયાભવિનિગ્રાહઃસર્વથા ન ત્યજેત् શ્રયમ् ॥

અર્થ:—શક્તિ પ્રમાણે સ્વર્ધર્મનું આચરણ કરે, વિમુખ
કરનાર વિધર્મથી દૂર રહે, ઈંદ્રિયોદ્ધી ઘોડાને વશ રાખો. આ
પણ વસ્તુનો કોઈ હિવસું ત્યાગ કરે નહિ.

સ્વયાર્મિદ્રિયકાર્યાણીત્યુક્ત્યા ધૈર્યવિભંજનઃ ॥

વિવેકસ્ય વિરોધ્યેવ તદસ્ફૂર્તિકરો યતઃ ॥૨૬॥

આશ્રયસ્તુ કથં સિધ્યેન્મનોવિક્ષેપસંભવાત् ॥

ભક્તિમાર્ગઃપિ મૂલત્વાસ્ત્યાગસ્ય ન હિ સિધ્યતિ ॥૨૭॥

અર્થ:—સ્વયાર્મિદ્રિયકાર્યાણિ એ વાક્યવડે શુક્તિપુરઃસર
જગ્યાવવામાં આઠ્યું છે કે (કામ) ધૈર્યને તોડનાર છે, અને તે
વિવેકનો વિરોધી હોવાથી તેને લીધે વિવેકની અસ્કૃતિ (વિ-
સ્મૃતિ) થાય છે. ૨૬

એ પ્રમાણે વિવેકનો નાશ થતાં મનમાં વિક્ષેપ થવાથી
ભગવાનાશ્ચ સિદ્ધ થઈ શકે નહિ. ઈન્દ્રિયવિષયનો ત્યાગ એ
શુક્તિમાર્ગનું મૂળ કારણ હોવાથી ઈન્દ્રિયોના વિષયોના ત્યાગના
અલાવે શુક્તિમાર્ગ સિદ્ધ થતો નથી. ૨૮

विवेकनः—विवेकैर्यैर्ग्राम्य नामना ॥ अंथमां श्रीमहार्य-
चरणे ४५ छे के—

स्वयमिदियकार्याणि कायवाङ्मनसा त्यजेत् ॥

अर्थः—“ धन्दियोनां पोतपोतानां कायोनेकायाथी, वाणीथी
अने मनथी तज्ज्वां” ए वाक्य उपरथी २५४ रीते समन्वय छे
के बो धन्दियो पोतपोताना विषयोमां वग़गी २५५ तो तेथी
धैर्यो लंग थाय.

धैर्य एटले आधि, व्याधि अने उपाधि अथवा आध्या-
त्मिक आधिलै॥१४ अने आधिहैविक ए त्रिंशु प्रकारनां हुःभोने
सर्व प्रकारे सर्वद्वा सहन करवां, तथा सो पुत्रादिक तरक्की थती
हेरानगति सहन करवी ते.

हेरेक धन्दियने पोताना प्रिय विषयनी प्राप्ति न थतां
हुःभनी लागाणी थाय छे. ए हुःभनी लागाणीम्हो सहन करी
हेरेके धन्दियोनो निश्चहु करवो ए अक्षिभार्गमां आवश्यक छे.
एम करवामां न आवे तो धैर्यो नाश थाय.

वांगो काम ए विवेको विरोधी छे. विवेक एटले प्रभु
सर्व वस्तु पोतानो इच्छा प्रमाणे करशो तेवी समज. सर्व वस्तु
करवाने ते समर्थ छे, अने शुं करवाथी पोताना लक्षाज्ञनो सुभी थशो
ए वात पोतेज सारी पेठे ज्ञाने छे, भाटे अमुक वस्तु करवानी
एमने प्रार्थना करवी ए उपयोगी नथी. आपत्ति, अति वज्रे
कर्माने विषे हुठनो त्याग करवो, अने धर्म अधर्मनोज मात्र
विचार करी अलिमाननो त्याग करी लौकिक वस्तु करवाना आ-
शहुने छोडी हाँ सर्वथा प्रभुनी इच्छाने आधीन थवुं, ए प्र-
माणेनी वर्ताणुकने विवेक कर्णे छे.

कामी भनुप्य हुमेश पोतानी भरणु प्रमाणे वर्तवाना
आशहुवाणो होय छे, ए कारणुथी उपर कहा प्रमाणेनो ए-
नामां विवेक हाँ शक्तो नथी.

વિવેક અને ધૈર્ય હોય તોજ મન વિક્ષેપ વગરનું થાય. એ ખન્નેનો નાશ થતાં પ્રલુનો દદ આશ્રય રાખવાનું સામર્થ્ય રીતે આવી શકે ? પ્રલુના ઉપરજ દદ આશ્રય રાખવો એ વાત નિશ્ચિત અને એકાત્મ મન સિવાય અની શકે નહિ. જ્યાં સુધી મન એક વિષય ઉપરથી ભીજા વિષય ઉપર અને ભીજાથી ગીજા ઉપર બટકતું હોય ત્યાં સુધી તેનામાં આશ્રય રાખવા જેટલી સ્થિરતા રહે નહિ. ભક્તિમાર્ગમાં વિવેક, ધૈર્ય અને આશ્રયથી ઇલ સિદ્ધ થાય છે; તે સર્વનો શત્રુ કામ છે. એ રીતે કામ એ સર્વ પ્રકારે ભક્તિ માર્ગનો વિરોધી છે એમ ધતાવવામાં આવ્યું છે. અથડર્ટા કહેછે કે ઉન્નિદ્રયના વિષયોનો ત્યાગ એ ભક્તિમાર્ગનું એક આવશ્યક તરફ છે. એ તરફપ્રાપ્તિ કર્યા સિવાય ભક્તિમાર્ગ સિદ્ધ થઈ શકતો નથી.

વાણાપણે કૃष્ણયોગः સર્વથા ત્વાંતરે મતઃ ॥

પરं તૂભ્યથાત્યાગો મૂલમત્ત્ર ન સંશયઃ ॥ ૨૮ ॥

કામે સતિ કર્થ ત્યાગઃ સાપેક્ષસ્ય પ્રસિદ્ધ્યતિ ॥

તસ્માદ્વિચાર્ય તદ્રૂપં દુરતિક્રમણં સ્વતઃ ॥ ૨૯ ॥

શરણીકરણીયં શ્રીનિજાચાર્યપદાંબુજમ् ॥

સાધનાનામભાવેઽપિ સ્વબલાઽખિલ સાધકમ् ॥ ૩૦ ॥

તત એવ ચ નિસ્તારો દોषપોષયુતાત્મનામ् ॥

નાન્યાગતિગોંકુલેશભજનાનંદકાંક્ષિણામ् ॥ ૩૧ ॥

ઇતિ શ્રીહરિશાસ્ત્રવિરાચિતં કામાખ્યદોષ વિવરण સંપૂર્ણમ्

અર્થ:—ઉન્નિદ્રયોના વિષયોનો અહારથી ત્યાગ કૃપણુના યોગની પ્રાપ્તિ કરે છે એને અંતર ત્યાગ હોય તો સર્વથા શ્રાંકૃપણુની પ્રાપ્તિ થાયજ એમ માનવામાં આવ્યું છે. તેથી ઉન્નિદ્રય વિષયોનો બાહ્ય અને અંતર ત્યાગ ભક્તિમાર્ગનો મૂલ પાયો છે. એમાં કંઈ સંશય નથી. ૨૮.

ને કામવાસના વ્યાપ્ત હોય તો મુમુક્ષુને ત્યાગની સિદ્ધિ શી રીતે થઈ શકે ? કેમકે કામ એ બીજુ વસ્તુઓની છચ્છાવાળો છે. તેટલા માટે કામના ઝપનો વિચાર કરીને તો (કામરૂપી) પાપનું ઉદ્ઘાંધન કરવાને માટે શ્રી નિબાર્યાર્થના* ચરણુરવિંદું શરણુ લેવું જોઈએ. એ ચરણુરવિંદુ કામના વિજયને વિષે સાધનનો અભાવ હોય તો પણ પોતાના ખણથી સર્વ કરવાને સમર્થ છે.

૨૯-૩૦

તેથી કરીને શ્રી આચાર્યનું ચરણ સર્વ પ્રકારના હોષેચુક્તા મનુષ્યનો નિસ્તાર કરનાં છે અને ભગવાનું ભજનાનંદની આકંક્ષાવાળાને માટે એજ માર્ગ (ગતિ) છે. ભીજે કોઈ માર્ગ નથી. ૩૧

વિવેચન— ધનિદ્રય વિષય ત્યાગના શ્રી હરિરાયજી એ ભાગ પાડે છે, એક બાધ્ય ત્યાગ અને એક આંતર ત્યાગ. બાધ્ય ત્યાગ એટલે કામ્ય વિષયનો આદ્યોપકરણ (દેહ, ધનિદ્રય ઈંદ્ર) થી ત્યાગ, આંતર એટલે આંતરોપકરણ (વૈરાગ્ય) થી ત્યાગ.

મંદ્વાડના વખતમાં માંહો માણુસ અમુક પદ્ધાયો તને છે એ અહારનો ત્યાગ છે. એ પદ્ધાયો તજવાથી એ પદ્ધાયોપરના ઝંગ્રી કે પ્રીતિનો જ્યારે નાશ થાય ત્યારે આંતર ત્યાગ થયો કહેવાય.

કામ્ય વિષયોનો અહારથી પણ ત્યાગ કરવો એ કાંઈ સહેલું કામ નથી અને તે નિરથી પણ નથો, કેમકે તેવા ત્યાગથી પ્રીતિમાં વધારે થતો એટકે છે અને કાગાંતરે તે પ્રાતિ નષ્ટ પણ થાય છે. પ્રલુ તરફ વળોંડા મનને એ ત્યાગથો પ્રલુ તરફ વધારે વાળવાને વખત મળો છે, અને તેને લીધે શ્રીકૃપણુનો યોગ, શ્રીકૃપણુની લક્ષ્મિ, ઉત્પન્ન થાય છે. જો વિષયોનો આંતર ત્યાગ થાય એટલે તેઓની છચ્છાગના મૂલનું પણ છેદન થાય તો લક્ષ્મિ ઉત્પન્ન થયા વગર રહેજ નહિ.

* શ્રીમહવક્ષભાચાર્યજીનું શરણ.

કન્દુલિયવિપરોનો ખડૂરથી અને અંહરથી ત્યાગ કરવો એ અક્ષિતમાર્ગનો ભૂળ પાયો છે એમાં સંશય નથી.

પોતાના આચાર્ય (શ્રીમહવક્ષલાચાર્યજી) નું મરણ કરવાથી તેમના બોધ અને વચ્ચે ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી તે પ્રમાણે વત્તિવાથી, કામડુપી પાપનું ઉલ્લંઘન થઈ શકે છે.

શ્રી કૃષ્ણના ભજનાનંદની આકંક્ષાવાળાને મારુ તો શ્રીમદ્દાચાર્યચરણ-એમનો બોધ-એમના ગ્રંથો-એમનું ચરિત્ર વગેરે કામના વિષયોના ત્યાગની ખાળતમાં વિજય પ્રાપ્ત કરાવવાને સમર્થ છે.

શ્રીમદ્દાચાર્ય (શ્રીમહવક્ષલાચાર્ય) શ્રીકૃષ્ણના મુખાંજિનિપુણું એટલે નિત્યજ વિરાજમાન છે. કામ અક્ષિતમાં પ્રતિખંધ રૂપ છે, એટલે એનું દમન કરવાની આવસ્થાકૃતાજ છે. જીવથી તે અની શકે નહિ તો એ કામને પણ અશન કરી જય એવા આચાર્યશ્રીના મુખાંજિનનો આશ્રય કરવો, કે જેથી કામ જીતાઈ રૂલાતમક શ્રી કૃષ્ણના સ્વરૂપની પ્રાપ્તિ થાય.

પતિ શ્રી હરિશાયજીએ રચેલું કામાખ્યહોષ વિવરણ

દીક્ષા સહિત સમાપ્ત.



- સર્વોચ્ચ પરીક્ષા
१. દાનાર્થીનું વિભાગ પઢણું પડેલું ગીતાથી
(ભાગાંતર ગ્રનાથ અને બાળરાધ્યકાર નામની
શીકના સારસાચે). કી. ૩. ૧
 ૨. શ્રીમહ વદ્વલાચાર્યલુ (બ્યાચાર્યલુ મહાપ્રભુલ)
તુ ઐતિહાસિક લુધન-ચરિત્ર. (અભિજાળ તથા
શુદ્ધાર્દેત-સિદ્ધાંત ઈ. સંખાંધી સપ્રમાણ અને સરલ
વિવેચન સાચે.) કી. ૩. ૨.
 ૩. શ્રી કૃષ્ણલીલાભૂત પ્રથમ લાગ. (પરમાત્મા શ્રી
કૃષ્ણના અવતારની લીલાઓનું પરમ રહસ્ય
જાળવનાર અખૂબ થયા). કી. ૩. ૧)
 ૪. માલા પ્રસંગ. (શ્રીમહ ગોસ્વામી જોકુળનાથલુના
અપ્રતિમ સ્વર્ધમ્ય રક્ષણનો ધતિહાસ). કી. ૩. ૦૧
 ૫. શ્રી હરિરાયલુ કૃત કામાખ્ય દોષ વિવરણુ, (મૂળ
ભાગાંતર તથા વિવેચન સાચે). કી. ૦-૨-૦
 ૬. શ્રીમહ વદ્વલાચાર્યલાના લુધન, તત્ત્વવિદ્યા અને
ઉપરેશા સંખાંધી વ્યાખ્યાન (કલકત્તાની કુન્ઝે-શાન
ઓઝ રીલોલુઅ-સમાં આપેલું) દુશ્રેણ તથા
ગુજરાતી લૈટિની કી. ૦-૨-૦
 ૭. શ્રીમહ વદ્વલાચાર્યલુ પ્રતિપાહિત શુદ્ધાર્દેત સિ.
દાંત (ત્રણ સાહિત્યપરિપ્રથમાં આપેલું વ્યાખ્યાન). કી. ૦-૨-૦
- મધ્યચાનાં ઉકાણું:- એન. એમ. બ્રિપાઠીની કં. સુંધરી.
ગુજરાતી પંચની ઓસ્રીસ. અમદાવાદ.
અંગ્રેજીસમ મુકુંદલ-કાલભાઈ-સુંધરી.
ખીલાં પુરલોડો વેચનારને લાં
- ઉપરનાં પુરતો તથા વેણું ધર્મ સંખાંધીનાં હરેક પુરનું નાનીઓનાં
થી પુછિએનીય પુરવકાશમાં શ્રીબેણનાસ પીતાંભરદાસ થાણ, પાસેણી
મધ્ય ભાગી.

